

M.A. (ECONOMICS) Semester - 1 (CBCS) Examination**Nov/Dec-2023 (SYLLABUS YEAR JUNE-2018)****MANAGERIAL ECONOMICS(ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ સંચાલકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સવિસ્તર સમજાવો.
- પ્રશ્ન-૨ માંગની મુલ્યસાપેક્ષાનો અર્થ આપી, માંગની મુલ્યસાપેક્ષતા માપવાની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સાથે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ ચાલુ વસ્તુની માંગની આગાહીની પદ્ધતિઓ વિવિધ ઉદાહરણ સાથે સમજાવો.
- પ્રશ્ન-૩ સમતુલ્ય બિંદુ એટલે શું? સમતુલ્ય બિંદુ વિશ્લેષણ ઉદાહરણ અને આકૃતિ સાથે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ પુણ હરિફાઈ એટલે શું? પુણ હરિફાઈમાં કિંમત નિર્ધારણ ઉદાહરણ અને આકૃતિ સાથે સમજાવો.
- પ્રશ્ન-૪ ટુકડા ગાળામાં અને લાંબા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચેના સબંધો ઉદાહરણ અને આકૃતિ સાથે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ સંગઠનના ધ્યેય જણાવી, નવી સદીના ધંધાકીય સંગઠનોના ધ્યેય તમારા મતે સમજાવો.
- પ્રશ્ન-૫ ટ્રેન્ડનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
- 1) ઈજારો.
 - 2) પરીવર્તનશીલ ઉત્પાદન પ્રમાણનો નિયમ.
 - 3) સંચાલકીય અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત આપો.
 - 4) નફાનું મહત્તમીકરણ.

ENGLISH VERSION

- Que-1 Give the definition of Managerial Economics. Explain the nature of managerial economics. (14)
OR
- Que-1 Explain the scope of managerial economics in detail.
- Que-2 Given the meaning of Elasticity of demand. Examples of different methods of measuring price Elasticity of demand Explain with. (14)
OR
- Que-2 Explain with the method of forecasting demand for manufactured goods with example.
- Que-3 What is equilibrium point? Explain breakeven point analysis with example and diagram. (14)
OR
- Que-3 What is perfect competition. Explain pricing methods under perfect competition with example and diagram.
- Que-4 Explain with example and diagram relationship between cost and production in short run and long run. (14)
OR
- Que-4 State the objectives of the organization. Explain in your opinion the objectives of business organizations of the new century.
- Que-5 Write Short Notes: (Any Two) (14)
- 1) Monopoly.
 - 2) Law of variable production proportions.
 - 3) Distinguish between managerial economics and macro economics.
 - 4) Profit maximization.
